

## સિટી ઓફ બ્રેમ્પટન રહેવાસીઓને વેરા ભરવામાં વિલંબની મંજૂરી આપે છે અને પાંચ મહિના સુધી તમામ દંડ જતા કરે છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (21 માર્ચ 2020) – આજે, સિટી ઓફ બ્રેમ્પટને પાંચ મહિનાની માર્ચ 18થી 19 ઓગસ્ટ 2020ની અવધિમાં થતા વેરા ચૂકવણા પર વ્યાજ અને લેટ ફી COVID-19ના ઉપદ્રવને કારણે જતી કરી છે. ભવિષ્યની કાઉન્સિલ સભામાં આ નિર્ણયને બહાલી અપાશે.

સિટીના ઇમર્જન્સી મેનેજમેન્ટ પ્લાનની કલમ 3.8 હેઠળ કટોકટી દરમિયાન, જેમકે પ્રવર્તમાન COVID-19ની મહામારીમાં, સિટીને એવી તમામ કાર્યવાહીઓ કરવાની સત્તા પ્રદાન થયેલ છે "જે જીવ, મિલકત, પર્યાવરણ અને સિટી ઓફ બ્રેમ્પટનની સીમાઓની અંદરના અર્થતંત્રને બચાવવા માટે જરૂરી હોય."

આપણા સમુદાયની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા COVID-19ની કટોકટી દરમિયાન આ તેમજ બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સેવામાં થયેલ ફેરફારો અંગેની જાહેરાત સિટીની નિરંતર ચાલુ રહેલ અગ્રિમતાઓ સાથે સુસંગત છે.

રહેવાસીઓ અને વ્યવસાયોએ નીચેની બાબતની નોંધ લેવી:

- માર્ચ 18 સુધીમાં ચૂકવવાપાત્ર વેરાના દ્વિતિય હપતા અથવા ત્રીજા હપતા માટે જે એપ્રિલ 22 સુધી ચૂકવવાપાત્ર છે તે માટે કોઈ વ્યાજ કે લેટ ફી લેવાશે નહીં.
- જેઓએ સિટીને તેઓના એપ્રિલના વેરા હપતા માટે પોસ્ટડેટડ ચેક મોકલ્યા હોય અને ચૂકવણું રદ કરવા માંગતા હોય તેઓ એપ્રિલ 15 સુધીમાં 311 પર કોલ કરી તેમ કરી શકે છે.
- એપ્રિલ 1, 15 અને 22 માટેના એપ્રિલના હપતા તેવા લોકોના કપાશે જેમણે પોતાની બેંક મારફત વેરાના ચૂકવણા પૂર્વ અધિકૃત (પ્રિ-ઓથોરાઈઝ) કર્યા હોય. જેઓએ મે માસ માટેના વેરાના ચૂકવણા પ્રો ઓથોરાઈઝ કર્યા હોય તેઓ પોતાના હપતા 311 પર કોલ કરીને રદ કરી શકશે. પછીની તારીખે પ્રિ 'ઓથોરાઈઝ કરેલ ચૂકવણા ફરી શરૂ કરવા માટે ચૂકવણાધારકે સિટીને ફરીથી અરજી કરવાની જરૂર પડશે.
- વેરાના ચૂકવણા સિટી દ્વારા પ્રાપ્ત કરવા અને તેની પ્રક્રિયા કરવી ચાલું રહેશે. ચૂકવણાના વિકલ્પોની પૂર્ણ સૂચિ [અહીં](#) જુઓ.

કોઈપણ પૂછપરછો માટે [આ પત્રકનો ઉપયોગ કરો](#).

## અવતરણો

"આ મહામારી દરમિયાન આપણા રહેવાસીઓએ જે વાસ્તવિક આર્થિક પીડા અને સંઘર્ષનો સામનો કરવો પડશે તે બ્રેમ્પટન કાઉન્સિલ સમજી શકે છે. તેથી અમે દરેક રહેવાસીને તક આપી રહ્યા છીએ કે તેઓ પાંચ મહિના સુધી દંડ વિના મિલકત વેરો ભરવામાં વિલંબ કરી શકશે. અમે તમારે માટે કાર્ય કરીએ છીએ અને આર્થિક પ્રતિકૂળતાના આવા સમયે સમાજની શું ઈચ્છા છે તે અમે સ્પષ્ટપણે અને ચોક્કસપણે સાંભળી શક્યા છીએ."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"સિટી માટે તેના સમાજની જરૂરિયાતોની ઉચ્ચતમ અગ્રિમતા છે, ખાસ કરીને આવા પડકારરૂપ સમયમાં. અમે ઝડપથી અને અસરકારક રીતે જવાબી કાર્યવાહીઓ કરી રહ્યા છીએ જેથી બ્રેમ્પટનવાસીઓ અને વ્યવસાયોની શ્રેષ્ઠતમ રીતે સેવા કરી શકીએ. સિટીની સવલતો બંધ છે તે દરમિયાન ઘણી બધી સેવાઓ અને સપોર્ટ્સ વૈકલ્પિક રીતે ઉપલબ્ધ રહ્યા છે.

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે સેક્ટર માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

### મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)